

**Ref: SEL/2023-24/00081**

**August 16, 2023**

To,  
The Dy Gen Manager  
Corporate Relationship Dept  
**BSE Limited**  
PJ Tower, Dalal Street,  
Mumbai- 400 001

To,  
**National Stock Exchange of India Ltd.**  
Exchange Plaza, Plot no. C/1, G Block,  
Bandra-Kurla Complex, Bandra (E),  
Mumbai - 400 051  
Fax : 022-26598237-38

**Equity Scrip Code:532710**

**Equity Scrip Name: SADBHAV**

**Sub:-Publication of Unaudited Financial Results for the Quarter ended on June 30, 2023 Newspaper Publication.**

In compliance of provisions of Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we are enclosing the copies of newspaper advertisements for the Financial Results of the Company for the quarter ended on June 30, 2023 (Q1) which have been Published on dated August 15, 2023 in Free Press Newspaper in Ahmedabad Edition (English) and Lokmitra Newspaper in Ahmedabad Edition (Gujarati).The aforesaid results have been approved by the Board of Directors in its meeting held on August 14, 2023.


The same has been made available on the Company's Website [www.sadbhaveng.com](http://www.sadbhaveng.com).

Thanking You,

Yours Faithfully,

**For, Sadbhav Engineering Limited**

**Shashin V. Patel**  
**Chairman and Managing Director**  
**DIN: 00048328**



**Sadbhav Engineering Limited**

Regd Office: "Sadbhav House", Opp. Law Garden Police Chowki, Ellisbridge, Ahmedabad – 380006

T : +91 79 26463384 F : +91 79 26400210 E : [info@sadbhav.co.in](mailto:info@sadbhav.co.in) Web : [www.sadbhav.co.in](http://www.sadbhav.co.in) CIN : L45400GJ1988PLC011322

# Beware! Dodgy digital deals can get your bank account frozen

AHMEDABAD: Picture this: You're enjoying a delightful family lunch at a local restaurant, ready to settle the bill using the unified payment interface (UPI), only to find yourself plunged into a nightmare of frozen bank

accounts and police investigations. Pratinth Shah, 52, found herself in this situation after her UPI transaction declined. A call to her husband revealed that her UPI account had been implicated in an online fraud

case, a consequence of her teenage son's occasional use of the account to purchase bitcoins. As the day unfolded, she received more shocking news: Along with her account, the police also froze the bank accounts of her

father-in-law to whom she had transferred money, the provision store she shopped at, and the gymnasium where she paid the membership fee online.

This unsettling experience isn't a work of fiction. It's a stark reminder of the real and increasing threat of cybercrime. In a world where digital transactions have become routine, the popular UPI payment system and peer-to-peer (P) platforms for bitcoin trading offer convenience in paying money to acquaintances and strangers. However, it could also put you in the crosshairs of the police and the banks.

In financial fraud cases, scamsters often transfer money to separate bank accounts, buy products or invest in various services. Subsequently, when police receive a complaint, they quickly ask banks to freeze the accounts to which the swindled money has been diverted. Apart from UPI payments, the police also freeze accounts that received deposits through NEFT, RTGS, and cheques. To prevent further diversion of the swindled money, all accounts linked to the one in which the money arrived or was sent are also frozen.

Every day, about 355 to 477 people are coned by cybercriminals in Gujarat. In just one week, the police froze the bank accounts of 1,065 to 1,431 individuals. Explaining the intricate web of cybercrime, DySP of Gujarat CID's cyber cell, B M Tank, details how cybercriminals employ multiple bank accounts to obscure their money trail

after swindling victims. The stolen money undergoes a labyrinthine journey, passing through layers of accounts before being withdrawn from ATMs or converted into bitcoins, he says, adding: "To trace this complex trail, investigators often have to navigate up to 8 levels of accounts beyond the fraudster's initial account." CID (crime) inspector Panjaj Patil, who oversees the 1930 cyber cell helpline, emphasizes that freezing bank accounts pre-emptively is the primary strategy to thwart cybercriminals.

He advises individuals to exercise caution when accepting financial connections on UPI and similar platforms. "Such transactions involve risk because a link is formed between your account and theirs. So, if they do anything wrong, it might create problems for you," he warns. Tank's guidance is crystal clear: Refrain from using your primary salary account for P bitcoin transactions or linking it to your UPI. He says, "Maintain some funds in an alternate bank account to avoid problems in case your account gets frozen."

## Air fares soar, hotels full as 1-Day weekend nears

AHMEDABAD: A quick monsoon escapade over the extended weekend of August 12-13 will cost at least 50% higher than usual as hotels are nearly full and air fares to domestic and international destinations have skyrocketed. Many hotels are witnessing a double-digit increase in booking inquiries.

"There is a significant increase in customers opting for luxury and upscale accommodations during this period. Despite the skyrocketing air fares, there is a marked rise in last-minute bookings for destinations like Mount Abu, Udaipur, Kumbhalgarh, Jodhpur, Jaipur, and even Khandala and Lonavala," said Manish Sharma, chairman, Tourist Development Society. International bookings are also high, especially to destinations like Dubai, Malaysia, Singapore, Thailand, Vietnam and Phuket. "Better flight connectivity means that more people are travelling abroad during this peak season," said another Ahmedabad-based travel operator. City-based professional Deboshri Das is taking a road trip to Goa with her husband and her pet, Mojo. "We try to travel with Mojo at least once a year. Since the weather has cooled down, we are looking forward to the trip and having some downtime on the beaches," said Das. Ambawadi resident Janki Rathod is headed to Dehradun to take in the serenity of the lush mountains. "This year, the season is buzzing. Many hotel bookings were made in June itself and overall, tariffs in hotels across popular nearby destinations have increased by 25-30%. In wake of the high air fares, which have grown by nearly 50%, many travellers are opting for road trips to nearby destinations," said Virendra Shah, chairman, Travel Agents Association of India (TAAI).

"We try to travel with Mojo at least once a year. Since the weather has cooled down, we are looking forward to the trip and having some downtime on the beaches," said Das. Ambawadi resident Janki Rathod is headed to Dehradun to take in the serenity of the lush mountains. "This year, the season is buzzing. Many hotel bookings were made in June itself and overall, tariffs in hotels across popular nearby destinations have increased by 25-30%. In wake of the high air fares, which have grown by nearly 50%, many travellers are opting for road trips to nearby destinations," said Virendra Shah, chairman,

## KOME-ON COMMUNICATION LTD

CIN: L74110GJ1984PLC021216  
 Reg. Off: 102, Dadri Faliya, First Floor, Rudraksh Complex, Atul Valsad Road, Opp. Ambe Mata Temple, Near Mukund Bridge, Valsad, Taluka Valsad, District Valsad, Gujarat Valsad 396001.  
 Email ID: info@komeon.in/ Tel. No: 67085160/ Web: www.komeon.in

### A7:E26 EXTRACT OF STATEMENT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30<sup>TH</sup> JUNE, 2023

Sl. No.	Particulars	Quarter ended 30.06.2023		Quarter ended 31.03.2023		Year ended 31.03.2023	
		(Unaudited)	(Audited)	(Unaudited)	(Audited)	(Unaudited)	(Audited)
1	Total Income from Operations	-	-	-	-	-	-
2	Net Profit / (Loss) for the period (before Tax and Exceptional items)	0.02	(130.29)	(1.75)	(130.29)		
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional items)	0.02	(130.29)	(1.75)	(130.29)		
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional items)	0.02	(130.29)	(1.75)	(130.29)		
5	Total Comprehensive Income for the period (comprising profit/loss) for the period (after tax) and other comprehensive income (after tax)	0.02	(130.29)	(1.75)	(130.29)		
6	Equity Share Capital	1,500.81	1,500.81	1,500.81	1,500.81		
7	Other equity (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	(185.90)	(185.90)	(55.82)	(185.90)		
8	Earnings Per Share (of 10/- each) (for continuing and discontinued operations)-Basic	(0.87)	(0.87)	(0.01)	(0.87)		
	Diluted	(0.87)	(0.87)	(0.01)	(0.87)		

**Note:**  
 1. The above is an extract of the detailed format of Quarter ended Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the website of the Stock Exchange www.bseindia.com and the Company's website.  
 2. The above results were reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on 14<sup>th</sup> August, 2023.  
 3. The above financial results have been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind-AS) as prescribed under Section 133 of the Companies Act, 2013 and other recognised accounting practices and policies to the extent applicable.

For and On Behalf of  
**Kome-On Communication Limited**  
**ASHISH RAJESHBHAI PATEL**  
**MANAGING DIRECTOR**  
 DIN: 07659614

Place: Mumbai  
 Date: 14<sup>th</sup> August, 2023

## SADBHAV ENGINEERING LIMITED

CIN : L45400GJ1988PLC011322  
 Regd office : "Sadbhav House",  
 Opp. Law Garden Police Chowki, Ellisbridge, Ahmedabad - 380006.  
 Phone: 079 - 40400400, Fax: 079 - 40400444 , Email: selinfo@sadbhav.co.in, Web: www.sadbhaveng.com

### EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS (STAND ALONE & CONSOLIDATED) FOR THE QUARTER ENDED JUNE 30, 2023

Sr. No.	PARTICULARS	Standalone			Consolidated		
		Quarter ended 30.06.2023	30.06.2023	31.03.2023	Quarter ended 30.06.2023	30.06.2023	31.03.2023
		(Unaudited)	(Unaudited)	(Audited)	(Unaudited)	(Unaudited)	(Audited)
1.	Total Income from Operations (Net)	40,493.39	27,016.80	88,917.28	71,116.23	50,049.38	177,893.69
2.	Net Profit / (Loss) for the period (before Tax and Exceptional items)	426.58	-2,236.58	-1,895.69	2,672.39	-12,954.50	-34,450.81
3.	Net Profit / (Loss) for the period before Tax (After Exceptional items)	633.62	-2,236.58	-34,386.35	-376.47	-22,783.38	-71,333.95
4.	Net Profit / (Loss) for the period after Tax (After Exceptional items)	105.57	-2,230.76	-34,648.38	-1,630.92	-23,761.46	-69,938.98
5.	Total comprehensive Income for the period (Comprising Profit/Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)	105.57	-2,230.76	-34,620.67	-1,630.92	-23,761.46	-69,900.57
6.	Paid up Equity Share Capital (Face value of Rs. 1/- each)	1,715.71	1,715.71	1,715.71	1,715.71	1,715.71	1,715.71
7.	Reserve (including Revaluation Reserve) as per Balance sheet of previous accounting year			106,516.11			158,066.51
8.	Network			108,231.82			175,222.22
9.	Earnings Per Share (of Rs. 1/- each) (for continuing and discontinued operations) - (* not annualized)	0.06*	-1.3*	-20.19	-0.6*	-10.05*	-34.34
	Basic and Diluted	0.06*	-1.3*	-20.19	-0.6*	-10.05*	-34.34

**Note:-**  
 1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchanges website (www.bseindia.com and www.nseindia.com) and on the Company website (www.sadbhaveng.com).  
 2. The above results were reviewed by the Audit Committee and approved & taken on record by the Board of Directors at their meeting held on August 14, 2023.

DATE : 14.08.2023  
 PLACE : Ahmedabad  
 For SADBHAV ENGINEERING LIMITED,  
**SHASHIN PATEL, Managing Director**  
 DIN: 000048328

## SADBHAV INFRASTRUCTURE PROJECT LIMITED

CIN : L45200GJ2007PLC049808  
 Regd Office : "Sadbhav House", Opp. Law Garden Police Chowki, Ellisbridge, Ahmedabad - 380006.  
 Phone No. 079 - 26463384, Fax : 079 - 26400210, Email : investor@sadbhavinfra.co.in, Web : www.sadbhavinfra.co.in

### Extract of Standalone and Consolidated Unaudited Financial Results for the Quarter ended June 30, 2023

Sl. No.	PARTICULARS	Standalone			Consolidated		
		Quarter ended 30.06.2023	30.06.2023	31.03.2023	Quarter ended 30.06.2023	30.06.2023	31.03.2023
		(Unaudited)	(Unaudited)	(Audited)	(Unaudited)	(Unaudited)	(Audited)
1.	Total Income from operations	129.97	237.67	131.73	894.14	2,401.78	3,202.88
2.	Net Profit / (Loss) for the period (before Tax and Exceptional items)	(250.69)	(200.24)	(207.25)	(796.53)	57.18	(753.60)
3.	Net Profit / (Loss) for the period before Tax (After Exceptional items)	(1,052.64)	(1,411.82)	(207.25)	(3,970.07)	(150.88)	(2,090.61)
4.	Net Profit / (Loss) for the period after Tax (After Exceptional items)	(1,052.64)	(1,411.82)	20.81	(3,575.48)	(210.95)	(2,179.98)
5.	Total comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)	(1,052.64)	(1,411.82)	21.19	(3,575.10)	(210.95)	(2,178.80)
6.	Paid up Equity Share Capital (Face value of INR 10 each)	3,522.25	3,522.25	3,522.25	3,522.25	3,522.25	3,522.25
7.	Other Equity (including Revaluation Reserve)	-	-	-	9,219.49	-	-
8.	Earnings Per Share (Face value of INR 10/- each) (not annualized) - INR Basic & Diluted	(2.99)	(4.01)	0.06	(10.15)	(0.65)	(6.17)
							9.71

**Note:-**  
 1. The above is an extract of the detailed format of Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Financial Results is available on the websites of the Stock Exchanges i.e. www.bseindia.com, www.nseindia.com and on the Company website www.sadbhavinfra.co.in.

DATE : 14.08.2023  
 PLACE : Ahmedabad  
 For and on behalf of the Board of Directors of  
**Sadbhav Infrastructure Project Limited,**  
**Shashin Patel,**  
**Director (DIN: 00048328)**

## MARUTI INFRASTRUCTURE LIMITED

CIN: L65910GJ1994PLC023742  
 Regd. Office : 802, Summit Building, Opp. Iscon Mega Mall, S. G. Highway, Ahmedabad, Gujarat-380015, India. Ph. : 079-26860740,  
 E-mail : maruti\_infra@yahoo.com, Website : www.marutinfra.in

### Extract of Consolidated Unaudited Financial Results for the Quarter ended on 30th June, 2023

Sr. No.	PARTICULARS	Quarter Ended 30.06.2023		Quarter Ended 30.06.2022		Year Ended 31.03.2023 (Audited)
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	
1.	Total Income from Operations	688.97	352.82	352.82	3518.33	
2.	Net Profit / (Loss) for the period (before tax, exceptional and/or extraordinary items)	118.67	8.67	140.06		
3.	Net Profit / (Loss) for the period before tax (after exceptional and/or extraordinary items)	118.67	8.67	140.06		
4.	Net Profit / (Loss) for the period after tax (after exceptional and/or extraordinary items)	88.89	7.69	101.35		
5.	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)	88.89	7.69	101.35		
6.	Equity Share Capital (Face value of Rs 10 each)	1,250	1,250	1,250		
7.	Other Equity	-	-	1,143.71		
8.	Earnings per equity shares (of Rs 10/- each) (for discontinued & continuing operation):					
	Basic :	0.71	0.06	0.81		
	Diluted :	0.71	0.06	0.81		

### Note - 1. STANDALONE DETAILS

Sr. No.	PARTICULARS	Quarter Ended 30.06.2023		Quarter Ended 30.06.2022		Year Ended 31.03.2023 (Audited)
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	
1.	Income from Operations	688.97	352.82	3518.33		
	Profit Before Tax	137.85	8.67	165.42		
	Profit After Tax	108.07	7.69	126.71		

The above is an extract of the detailed format of Financial Results for the quarter ended on 30th June, 2023 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results for the quarter ended on 30th June, 2023 are available on the Stock Exchange website i.e. www.bseindia.com and on the website of the company i.e. www.marutinfra.in.

For Maruti Infrastructure Limited,  
**Nimesh D Patel,**  
**Chairman & Managing Director,**  
 (DIN : 00185400)

PLACE : Ahmedabad  
 DATE : 14.08.2023

## SYMBOLIC POSSESSION NOTICE

**ICICI Bank**  
 Branch Office: ICICI Bank Ltd., Office Number 201-B, 2nd Floor, Road No. 1 Plot No. 83, WIPIT Park, Wagle Industrial Estate, Thane, Maharashtra-400604

Whereas The undersigned being the Authorized Officer of ICICI Bank Limited under the Securitisation, Reconstruction and Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) rules 2002, issued demand notices upon the borrowers mentioned below, to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice.

As the borrower failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Symbolic possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules on the below-mentioned dates. The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property in any manner which may be subject to the charge of ICICI Bank Limited.

Sr. No.	Name of the Borrower/ Loan Account Number	Description of Property/ Date of Symbolic Possession	Date of Demand Notice/ Amount of Notice (Rs.)	Name of Branch
1.	Thakor Maheshbhai & Thakor Ramli - LBABD0000980212 - LBABD0000599721 - LBABD0000599727	Flat No. C-603, 6th Floor, Block-C, Mangal Murti Heights Nr Dev Prime, Opp. K B Roy, Allezza, C1 Road Moje-Zundal, Chandkheda, Survey No. 2832/1, TFS No. 69, Pp No. 159/1, Gujarat Ahmedabad 382440/August 10, 2023	March 29, 2023/ 26,93,598,90/-	Ahmedabad
2.	Siddhesh Ganpat Purohit & Madhvi Siddhesh Patil - LBVP00005401139 & LBVP00005401144	Flat No 103, 1st Floor, Patel Co-Op Housing Society Ltd Vapi Kapani Road, Village- GIDC-Vapi, Dist/Valsad Housing Plot No. 398/P1, RS No. 112/P, Gujarat Vapi 396195/August 10, 2023	March 28, 2023/ 36,80,553,00/-	Vapi
3.	Tarashankar Basuri & Binakalambhar Basuri - Vaps-595191/August 10, 2023	Flat No-A/413, 4th Floor, Building-A, Sai Siddhi 2, Ramzanwadi, Chohanwadi Road, Near Mitsa Colony, Vaps-595191/August 10, 2023	March 28, 2023/ 6,69,645,00/-	Vapi
4.	Santia Rajendrakumar Agarwal & Abhishek Chandra Tulaites Sayan - LBVP00004858460	Flat No- 303, 3rd Floor, Building-B, Sun Signature, New Survey No. 1230, Opposite ICICI Bank Hariya Road, Vapi Ashvasa Road, Durgna, Vapi-396191/August 10, 2023	March 27, 2023/ 19,27,214,99/-	Vapi
5.	Krishna Shivkumar Kedia & Meena Krishna Kedia - LBVP00002429668	Flat No. 203, 2nd Floor, Building No. B/4, Pramukh Greens, Behind Pramukh Residency, Vaps-Daman Road, Chala, Farid, Valsad, Survey No. 1901 Paiker/1 Paiker 1, Vapi 396195/August 10, 2023	March 28, 2023/ 10,89,417,00/-	Vapi
6.	Kinjal Pradipbhai Gajre & Jayantibhai Gajre - LBVP00004974395	Flat No. 306, 3rd Floor, Indraprast, Jalarang Society, Moje-Chetala, Sr No 281/1/2, New Survey No. 1799, 1904, Plot No. 64-B, 65 Gujarat Vapi 396191/August 10, 2023	March 27, 2023/ 12,13,482,00/-	Vapi
7.	Alha Devi & Surya Bhushan Sharma - LBVP00004910967	Unit No 7, Stop And Go, Near Daman Check Post, Chala, District Valsad, Vapi- 396191/August 10, 2023	March 27, 2023/ 6,41,696,00/-	Vapi
8.	Surya Bhushan Sharma & Abhadevi Rambhahari Sharma - LBVP00002050104	3rd Floor, Building-C, Galatay Park, Daman Road, Chala, Vapi-396191/August 10, 2023	March 29, 2023/ 5,39,779,00/-	Vapi
9.	Pandya Ketan Dipakbhai & Pandya Sonal Ketan - LBRAJ0000578253 & LBRAJ0000578253	Flat No 304, 3rd Floor, Shree Ram Complex Nr Raju Madras Cafe, Gayakwadi Comerchs, Sheri No. 3/E, Sheri No. 18, City Survey No 500 (Plot No. 2) and Sheri No. 8, Rajkot 360001/August 11, 2023	March 29, 2023/ 19,55,181,00/-	Rajkot
10.	Kishanbhai Narshibhai Chandra Tulaites Sayan - LBRAJ00006231552 & LBRAJ00006147272	Flat No. 104, 4th Floor, Diamond Apartment, Back Bore Park, Near Bafali, off 150 Ft Ring Road, Jammagar, Survey No. 132, Plot No. 1 To 7, Sub-Plot No. 6/C, 6/D, Rajkot 360004/August 11, 2023	April 15, 2023/ 61,96,050,00/-	Rajkot
11.	Hardik Rameshbhai Sayani & Ramesh Chandra Tulaites Sayan - LBRAJ0000516401	Flat No 801, 8th Floor "Dwarka Hills", Jammagar Road, Plot No 102 & 103 RS No 9 of village Madhapur, Rajkot Gujarat 360001/August 11, 2023	March 23, 2023/ 5,25,628,00/-	Rajkot
12.	Rina Jirvijayvadi & Ravi Jirvijayvadi - LBJAM00005141904	Plot No 37, Sub-Plot No. 377, Rajmoti, H Siva Sai Naga, Rajkot Road Vilhpar R S No 22 Paika, Gujarat Jammagar 361001/August 12, 2023	March 27, 2023/ 17,31,445,99/-	Jammagar
13.	Khafi Hasan & Khafi Hajeun Alimamad - LBJAM0000528949	Sub Plot No- 111/2, Revenue Survey No- 669, Near Hussaini Chowk, Beside Garb Nawaz Park, Morkanda Road, Jammagar- 361001/August 12, 2023	March 24, 2023/ 4,56,865,00/-	Jammagar
14.	Rambabu Gangaprasad Verma & Verma Gita - LBJAM00005706285	Property 1) Sub Plot No. 105/13, Jalarang Nagar Bh Hanuman Templeoff Khambhalia Road, Moje-Sak, Rs No. 111/Paiker-1, Gujarat, Jammagar-361001/August 12, 2023	March 28, 2023/ 17,86,395,00/-	Jammagar
15.	Gad Iqbalbhai & Gad Mohan & Gad Guljandra - LBJAM0000570359	Sub Plot No 232/14, Revenue Survey No- 662, Rabbani Park, Near Makka Masjid, Morkanda Road, Jammagar- 361001/August 12, 2023	March 27, 2023/ 8,48,663,00/-	Jammagar
16.	Hajeun Alimamad Khafi & Hajeun Alimamad Khafi - LBVP00005781354 & LBVP00005781354	Sub Plot No- 111/2, Revenue Survey No- 669, Near Hussaini Chowk, Beside Garb Nawaz Park, Morkanda Road, Jammagar- 361001/August 12, 2023	March 24, 2023/ 9,61,185,00/-	Jammagar
17.	Vishal Madhubhai			

